



Jivan Jivava Matena Be Siddhanto

જીવન જીવવા માટેના બે સિદ્ધાંતો

* Chitroda Haresh Virji Bhai ** Dr. Sandip Ghetiya

* Research Scholar, CMJ University, Mehghalaya

** Research Guide, CMJ University, Mehghalaya

સિદ્ધાંત :- ૧

જ્યારે જીવનના દરેકક્ષેત્રમાં નિષ્ફળતા મળે ત્યારે આપણી જીંદગી દાવ પર લગાવી સાહસ ખેડવું જોઈએ.

દરેક ક્ષેત્રમાં પ્રયત્નો કરવાં છતાં સફળતા મળતી ન હોય, જીવનનાં બધા જ વિકલ્પો માટે સફળતા મળે જ નહિ. હવે કોઈ પણ રસ્તો ભાકી રહ્યો જ ન હોય. ત્યારે અને માત્ર ત્યાર જ પ્રથમ ધ્યેય પરિવર્તન કરવું અને એ ધ્યેય પરિવર્તન કર્યા છતાં પણ તે ક્ષેત્રમાં સફળતા મળતી ન હોય ત્યારે વ્યક્તિએ હતાશા કે નિરાશા (Frustration) અનુભવવી નહિ પરંતુ આપણી જીંદગી દાવ પર લગાવી સાહસ ખેડવું જોઈએ.

કોઈ વ્યક્તિ જ્યારે આવી પરિસ્થિતિમાં આવે ત્યારે અંતિમ પગલા રૂપી આત્મહત્યા (suicide) કરે છે પરંતુ એ કોઈ વિકલ્પ નથી. આ માટે એક એવો સિદ્ધાંત પણ છે કે ("Do OR Die") એટલે કેકરો યા મરો આવી પરિસ્થિતિ સર્જવી પડે. અહિ જો આપણને સફળતા મળી જાય તો એ આપણને જે અગાઉ સફળતા મળી હોય અથવા મળવાની હોય તેનાથી પણ વધારે અસર કરનારી અથવા વધારે ઉચિત હોય છે અને આ સફળતા સમગ્ર જીવનમાં એ શ્રેષ્ઠ સફળતા મળી

એમ માનવું અને પછી આગળ વધવું. હવે તમને વધારે ને વધારે સફળતા મળશે. કારણ કે લક્ષ્ય સાથે સાહસ તમારી સાથે જ છે.

સિદ્ધાંત :- ૨

જ્યારે આપણાં કારણે કોઈ નિર્દોષ સજીવના આંખમાં આંસુ આવે ત્યારે સમજવું કે આપણાં માં કંઈક ખામી છે અને એ ખામી આપણે સુધારવી જોઈએ.

આપણે સમાજના લોકો સાથે એવી રીતે વર્તવું જોઈએ કે આપણે કારણે કોઈ નિર્દોષ લોકો ને કોઈ પણ પ્રકારનું નુકશાન કે કોઈ અન્ય રીતે આપણે કોઈને નડતરરૂપ ન થવા જોઈએ. આપણે સમાજને બનતો પ્રયત્નો કરવા છતાં આપણે કોઈને ઉપયોગી થઈ ન શકીએ તો કાંઈ નહિ પણ કોઈને નડતરરૂપ પણ ન થવું જોઈએ.

અને વળી અહિ એ પણ ઉલ્લેખ કરેલ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિના આંખમાં આંસુ આવવા એટલે કે કોઈ વ્યક્તિ સમાજહિત વિરુદ્ધ કાર્ય કરતો હોય એની આંખમાં આંસુ તમારા કારણે આવેતો એ ઉચિત છે. અને એ આંસુ આવવાજ જોઈએ અને નહિતર એને સુધારવો જોઈએ.